

RO JEWELS LIMITED

810, Eighth Floore, Addore Asspire, Nr. Gulbai tekra BRTS Stop,
Panjrapole to University Road S A C Ahmadabad City Ahmedabad GJ 380015

CIN: U74999GJ2018PLC105540
Phone No.: 07922144429

Email- compliancerojewels@gmail.com
Website: www.rojewels.co.in

Date: December 19, 2023

To,
The General Manager-Listing
Corporate Relations Department
BSE LIMITED
PJ Towers, 25th floor, Dalal Street,
MUMBAI -400 001
Scrip Code - 540252

Dear Sir/ Ma'am,

Subject: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to above, please find enclosed the copy of newspaper advertisement dated 19th December 2023, which was published in Newspapers Business Standard and Jai Hind-Ahmedabad edition with regard to the Postal Ballot Notice duly considered and approved by the Board of Directors of the Company at their meeting held on December 15, 2023.

You are requested to take the same on records, upload at your website & intimate the same to the members of the Stock Exchange.

Thanking you,

Yours faithfully,

For, RO Jewels Limited

Shah Shubham
Bharatbhai

Digitally signed by Shah
Shubham Bharatbhai
Date: 2023.12.19 15:14:01
+05'30'

Shubham Bharatbhai Shah
Managing Director
DIN: 08300065

PUBLIC NOTICE FOR TITLE CLEAR
 This is hereby informed to General Public That, I have offered title clearance report for the properties mentioned below.
 That, The owner of land bearing R.S. No. 99 & 100, Block No. 96, after re-survey New Block No. 98 admeasuring 7135 sq.mtrs., T.P. Scheme No. 58 (Valak) Final Plot No. 4 admeasuring 4281 sq. mtrs. of Village: Valak, Sub District : Kamrej, District: Surat owned by M/s. Varni Infra A partnership Firm and declared that the original documents paiki Original registration fee receipt of sale deed vide reg. No. 549 on dated 6/7/1999 is lost by owner and declaring the same they have offered said property to my client Bank as security. Therefore, if any person, Bank, or Financial institute has any interest in the said property, contact at below address mentioned herein below within 7 days of publication of this notice with all relevant documents. Upon expiration of the notice period Bank will proceed further and afterwards there will be first charge of my client over the said properties and afterwards No rights/claim/Objection will be entertained.

Neha H. Koradia
 Advocate and Notary
 Office No. 8,9,10, Haridharshan Complex, Katargam Darwaja, Surat. Mo. No. 99090 90222

Suman O. Rajput
 Advocate
 403, Shubham, Por Mahollo, Nampura, Surat Mo. No. 98798 16360

ਪੰਜਾਬ ਨੈਸ਼ਨਲ ਬੈਂਕ Punjab National Bank
 ...the name you can BANK upon!

80 Vapi GIDC, Khushbu Plaza, Vapi
 APPENDIX IV [See Rule 8 (1)]
POSSESSION NOTICE (For immovable property)

Whereas, The undersigned being the Authorised Officer of Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 03/02/2017 under section 13(2) of the said Act calling upon the Borrower/ Mortgage/ Guarantor Mr. Pawan kumar D Mishra to repay the amount mentioned in the notice being Rs. 4,48,814/- (Rupees Four Lac Forty Eight Thousand Eight Hundred Fourteen Only) as on 31/01/2017 with further interest at the contracted rate and cost expenses etc., within 60 days from the date of the receipt of the said notice.

The borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on her under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on 15/12/2023.

The borrowers/Guarantors/Mortgagor in particular, and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount of Rs. 4,48,814/- (Rupees Four Lac Forty Eight Thousand Eight Hundred Fourteen Only) as on 31/01/2017 with further interest at the contracted rate and cost expenses etc., until payment in full.

The borrowers' attention is invited to provision of Sub Section (8) of the Section 13 of the Act in respect of time available to redeem the secured assets.

Description of the Property(s)
 All the piece and parcel of the immovable Property being Residential Flat No. 102 1st Floor, Jalaram Apartment., At Sr. No. 179/1/P1/P4/VII. Chhini, Vapi (Property in the name of Pawan Kumar D Mishra)

Date : 15/12/2023 | Place : Vapi | Authorised Officer, Punjab National Bank

ਬੈਂਕ ਔਫ਼ ਬਰੋਡਾ Bank of Baroda
 ...the name you can BANK upon!

POSSESSION NOTICE (Immovable Property)

Whereas, The undersigned being the Authorised officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice dated 27.06.2023 calling upon the borrower Rakesh Baliram More and Mr Raju Baliram More (borrower) and Shri Sunil Ramcharan Utekar (Guarantor), Shri Anil Balasaheb Shinde (Guarantor) and Mrs Kundanben Satishbhai Thakkar to repay the amount mentioned in the notice being Rs. 7,41,382.04/- (Rupees Seven Lakhs Forty One thousand Three Hundred Eighty Two and Four Paise Only) and interest thereon w.e.f. 25.06.2023 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 14th day of December of the year 2023.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Raopura Branch, Vadodara for an amount Rs. 7,41,382.04/- (Rupees Seven Lakhs Forty One thousand Three Hundred Eighty Two and Four Paise Only) interest thereon.

Description of the Immovable Property
 The Property of Land bearing R.S No 399 admn 39862.00 sq. mtr. Paiki 34304.00 sq. mtr, city survey number 3582 paiki constructed the scheme known as "Rajratna Society" paiki Block No C-241 admn 478 sq. ft. land, Total Land Area 60.42 sq. mtr constructed are 30.15 sq. mtr of Mouje Vadodara Kasba, Reg Dist Vadodara Boundaries as under: East: Internal Road, West: Block No 249, North: Block No 240, South: Block No 242

Place : Vadodara, Date : 14-12-2023 | Authorized Officer Bank of Baroda

RO JEWELS LIMITED
 810, Eighth Floor, AdoreAsspire, Nr. Gulbai Tekra BRTS Stop, Panjrapole to University Road S A C Ahmedabad City, Ahmedabad GJ 380015
 CIN : U74999GJ2018PLC105540 | Email: compliancerojewels@gmail.com
 Phone No.: 07922144429 | Website : www.rojewels.co.in

POSTAL BALLOT NOTICE TO MEMBERS
 Notice is hereby given that the resolution set out below is proposed to be passed by the Members of RO JEWELS LIMITED ("the Company") by means of Postal Ballot through remote e-voting only pursuant to the provisions of Sections 108 and 110 and all other applicable provisions of the Companies Act, 2013 ("the Act") read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") (including any statutory modifications) or regulations made thereunder, for the time being in force) and in accordance with the guidelines prescribed by the Ministry of Corporate Affairs for inter-alia conducting postal ballot through e-voting vide General Circulars Nos. 14/2020, 17/2020, 22/2020, 33/2020, 39/2020 and 10/2021 dated April 8, 2020, April 13, 2020, June 15, 2020, September 28, 2020, December 31, 2020 and June 23, 2021 respectively ("MCA Circulars"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR Regulations"), Secretarial Standard - 2 issued by the Institute of Company Secretaries of India and other applicable laws and regulations, if any.

Members should note that in terms of the General Circulars issued by Ministry of Corporate Affairs (MCA), no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote e-voting facility only. In accordance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Company is providing e-voting facility to its members, details of which are given in notes forming part of the notice. Reference to postal ballot(s) in this notice includes voting through electronic means.

Special Business:
ITEM NO: 1: TO INCREASE AUTHORISED SHARE CAPITAL OF THE COMPANY AND ALTER CLAUSE OF MEMORANDUM OF ASSOCIATION
 To consider, and if thought fit, to give assent or dissent to the resolution for increase in the authorised share capital of the company from Rs 10,10,00,00 to 21,00,00,000 by creating additional 10,90,00,000 (Rupees Ten Crore Ninety Lakhs Only) divided into 5,45,00,000 (Five Crore Forty Five Lakhs Only) equity shares of Rs. 2/- each ranking pari-pasu in all respect with the existing Equity Shares of the Company and consequently Clause V of the Memorandum of Association be and is hereby substituted by the following:
 "V. The Authorised Share Capital of the Company is Rs. 21,00,00,000 (Rupees Twenty One Crore Only) divided into 10,50,00,000 (Ten Crore Fifty Lakh only) Equity Shares of Rs. 2/- (Rupees Two Only) each."

ITEM NO: 2: APPROVAL OF RIGHT ISSUE OF SHARES
 To consider, and if thought fit, to give assent or dissent to the Right Issue of Equity Shares considered and approved by the Board of Directors of the Company at its meeting held on 15th December, 2023 subject to receipt of relevant approvals from Regulatory authorities, as may be required, issue of Equity Shares by way of Right Issue to the existing shareholders of the Company on a record date for an amount not exceeding Rs. 50.00 Crores.

1. In accordance with the MCA Circulars, this Postal Ballot Notice is being sent only by electronic mode to those members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on Friday, 15th December, 2023 ("Cut-Off Date") received from the Depositories and whose e-mail address is registered with the Company / Depositories. Physical copies of the Postal Ballot Notice along with postal ballot forms and pre-paid business reply envelopes are not being sent to members for this Postal Ballot.

2. Pursuant to Sections 108, 110 and other applicable provisions of the Act and the Rules made thereunder, the MCA Circulars and Regulation 44 of the Listing Regulations read with circular of SEBI on e-Voting Facility provided by Listed Entities, dated December 9, 2020, SS-2 and any amendments thereto, the Company is providing the facility to the members to exercise their right to vote on the proposed resolution electronically. The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") as the agency to provide e-voting facility.

3. Voting rights of a Member/ Beneficial Owner (in case of electronic shareholding) shall be in proportion to his/her/its shareholding in the paid-up equity share capital of the Company as on the e-voting Cut-Off Date i.e. Friday, 15th December, 2023.

4. The Postal Ballot Notice, explanatory statement along with e-voting instructions has been sent by the Company for seeking consent of the members on the resolution as set out in the Postal Ballot Notice only through e-mail on December 18, 2023 to all those members whose emails are registered with the Company or the Depository Participants or with KFin Technologies Limited, the Registrar and Share Transfer Agent of the Company ("RTA") and those members whose names appear in the Register of Members/ Beneficial Owners/ record of National Securities Depository Limited (NSDL) and Central Depository Service (India) Limited (CDSL) as on Friday, December 15, 2023 which is also the Cut-off date to reckon the paid up value of shares and voting rights of the Members.

5. The Notice is available on the Company's website i.e. www.rojewels.co.in and the websites of the Stock Exchange viz., BSE Limited i.e. www.bseindia.com and on the website of the National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com

6. The e-voting period commences at 9:00 A.M. (IST) on Monday, 18th December, 2023 and ends at 5:00 P.M. (IST) on Wednesday, 17th January, 2024. Members desiring to exercise their vote should cast their vote during this period, to be eligible for being considered.

7. The resolution, if approved, shall be deemed to have been passed on the last date of e-voting i.e. Wednesday, 17th January, 2024.

For RO Jewels Limited
 sd/- **Shubham Bharatbhai Shah**
 Managing Director (DIN : 08300065)

Date : 18/12/2023
 Place : Ahmedabad

E-AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE / MOVABLE PROPERTIES
 APPENDIX - IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

ZONAL STRESS ASSETS RECOVERY BRANCH, BARODA
SURAJ PLAZA-3, 4TH FLOOR, SAYAJIGUNJ, BARODA. PHONE : 0265 - 2360022 / 2360033

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISIO TO RULE 6 (2) & 8 (6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.
E-AUCTION DATE : 10.01.2024, TIME : 14.00 P.M. TO 17.00 P.M. - PROPERTY INSPECTION DATE : 02.01.2024, TIME : 11.00 AM TO 15.00 PM

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) / Mortgage and Guarantor (s) that the below described immovable property mortgaged / charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "Without recourse" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s / Mortgage/s / Guarantor/s / Secured Asset/s / Dues / Reserve Price / e-Auction Date & Time, EMD and Bid Increase Amount are mentioned below :-

Sr./ Lot No.	Name & Address of Borrower/s / Guarantor/s	Detailed Description of the movable/immovable properties with known encumbrances, if any	Total Dues	Reserve Price EMD and Bid Increase Amount
1.	M/s. Shyamram Dairy Farm 1. Mr. Narendrasinh Gulabsinh Bldhaiya At:-G-14, Shyam Vihar Apartment, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad-380015 2. Ms. Pintuben Rameshbhai Patel, At:-1001, SarveshwarTownship, Near Jai Ambe Nagar, Thaltej, Ahmedabad-380058	1) All that piece parcel of land admeasuring 900 Sq. Ft. bearing private Plot Villa No. DRV-01 in Phase 1 of the project DREAMSITY situated on Non-Agriculture land bearing R.S. No. 655/1/A/P of village Raval, Ta. Waghodia, Dist. Vadodara, in the name of Mr. Narendrasinh Gulabsinh Bldhaiya, in the Register Dist. Vadodara, Sub Dist. Waghodia and bounded as under: East: Society Road; West: Hanuman Mandir; North: Children Play Area; South: Open Place of party Plot Compound. STATUS OF POSSESSION: PHYSICAL, Property ID: BARB581520230011 2) All that part and parcel of the property of Ms. Pintuben Rameshbhai Patel consisting of private Plot No.A-2, land bearing Revenue Survey No.655/1/A/P, admeasuring about 48600.00 Sq. Ft. Phase 1 Dream City, Near ITM Vocational University, Village Raval, Ta. Waghodia, District Vadodara, and in the Register Dist. Vadodara, Sub Dist. Waghodia and bounded as under: East: Waghodia raval Road; West: Plot C-58, North: Internal Road and A-1; South: Open Place of ITM Vocational University. STATUS OF POSSESSION: PHYSICAL, Property ID: BARB581520230012	Rs. 1,58,11,316/- (Rupees One Crore Fifty Eight Lacs Eleven Thousand Three Hundred Sixteen Only) as on 06-08-2019 (inclusive of interest up to 29-01-2019) with further interest and expenses thereon until the full payment.	1) Rs. 7,30,000/- 2) Rs. 73,000/- 3) Rs. 10,000/-
				1) Rs. 1,03,25,000/- 2) Rs. 10,32,500/- 3) Rs. 10,000/-

For detailed terms and conditions of sale, please refer /visit to the website link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://ibapi.in>.
<https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp> Also, prospective bidders may contact the Authorized Officer on Tel. No. 0265 - 236022 / 0265 - 2360033. Mo. 9406831031.
 Date : 16.12.2023
 Place : Baroda
 Email: armsgz@bankofbaroda.com

Authorised Officer,
 Bank of Baroda

SCAN HERE
 For detailed terms & conditions.

PUBLIC NOTICE

I, Kunal Mashruwala, Proprietor of Mash Capital, a SEBI-registered investment adviser holding registration no. INA000005689 and BASL membership certificate no. BASL 1371, having my office at B-83 Satellite Plaza, Vastrapur, Ahmedabad - 380015, Gujarat, will be surrendering my certificate of registration as an investment adviser (RIA). This is a public notice per SEBI guidelines. For any grievances, please visit <https://www.scores.gov.in>

sd/-
Mash Capital

Mota Varachha Branch, Silver Business Point VIP Circle
 Utran, Surat-395105 PH : 0261- 2499014,
 E-MAIL: motsur@bankofbaroda.com

POSSESSION NOTICE (For Immovable property)
[Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 04.10.2023 calling upon the borrower/mortgagor Mr. Shyamal Girdharilalji Suthar (Borrower) Mrs. Meenaben Shyamalji Suthar (Co-Borrower) and Mr. Tulsihbhai Gordhanbhai Mistry (Guarantor) to repay the amount mentioned in the notice Rs.11,79,443.01/- (Rupees Eleven Lakh Seventy Nine Thousand Four Hundred Forty Three and Paise One Only) & interest thereon, plus other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower/mortgagor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 14th day of December of the year 2023. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs.11,79,443.01/- & interest thereon, plus other charges.

Description of the immovable property
 All the piece and parcel of the Immovable property bearing Plot No.16 admeasuring about 76.00 sq. yds. Equivalent to 63.54 sq. mtrs (As per No. K/16 admeasuring about 51.60 sq. mtrs.) at Nandini Row House situated on the land bearing Rev.S. No. 131 its Block No. 216 of Village: Kathodara Ta: Kamrej Dist: Surat. Boundaries are:North : Plot No. 15, East : Society Internal Road, South : Plot No. 17, West :Boundary of Society

Date : 14.12.2023 | Place : Surat
 Authorized Officer, Bank of Baroda
 Mota Varachha Branch Surat

Man Darwaja Branch, 1st Floor, Krishna Market, Near Kinnary Cinema, Man Darwaja, Ring Road, Surat - 395002
 Ph. : 0261-2325145, E-mail : surman@bankofbaroda.com

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property)
[Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 15.05.2021 calling upon the Borrower/Mortgagor Mr. Rajanish Kumar Bhawalchandra Jaiswal (Borrower), Mrs. Anjuben Bhawalchandra Jaiswal (Co-Borrower) and Mr. Bhawalchandra Baburam Jaiswal (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 16,78,111.26 (Rupees Sixteen Lakh Seventy Eight Thousand One Hundred Eleven and Paise Twenty Six Only) plus interest & other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 15th day of December of the year 2023.

The Borrower's Attention Is Invited To Sub-Section (8) Of Section 13 of the Act, In Respect Of Time Available, To Redeem The Secured Assets.

The Borrower/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 16,78,111.26 plus interest & other charges.

Description of the immovable property
 All the piece and parcel of the immovable property known as Plot no 55/G. Sahkar Park, Vibhag- 1. Near Sakar Bungalow, Soyani, Surat.

Date : 15/12/2023
 Place : Surat
 Authorized Officer, Bank of Baroda
 Maan Darwaja Branch Surat

Man Darwaja Branch, 1st Floor, Krishna Market, Near Kinnary Cinema, Man Darwaja, Ring Road, Surat - 395002
 Ph. : 0261-2325145, E-mail : surman@bankofbaroda.com

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property)
[Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 16.04.2021 calling upon the Borrower/Mortgagor Mr. Shivratn Jugheshwar Barnwal (Borrower) and Mrs. Ishadevi Shivratn Barnwal (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 9,92,349.08 (Rupees Nine Lakh Ninety Two Thousand Three Hundred Forty Nine and Paise Eight Only) plus interest & other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 15th day of December of the year 2023.

The Borrower's Attention Is Invited To Sub-Section (8) Of Section 13 of the Act, In Respect Of Time Available, To Redeem The Secured Assets.

The Borrower/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 9,92,349.08 plus interest & other charges.

Description of the immovable property
 All the piece and parcel of the immovable property known as Flat No. 208 on the 2nd Floor of B Tower of Shree Tirupati Balaji Town admeasuring about 716.92 Sq ft. or 44.85 SQ. Mtrs bearing revenue survey no 140/2,170,171 Block no. 222.223.224 situated at Village : UNN, TAL : MAJURA, Dist: Surat which has been given F.P. No: 169,170 & 171 in T.P Scheme No.: 59 (UNN) in the city of Surat.

Date : 15/12/2023
 Place : Surat
 Authorized Officer, Bank of Baroda
 Maan Darwaja Branch Surat

Companies, Insight Out

Companies, Monday to Saturday

To book your copy,
 sms reaches to 57575 or email order@bsmail.in

Business Standard
 Insight Out

[bsindia](https://bsindia.com) business.standard business-standard.com

